



WEL COME TO SHRI MAMAL MATAJI BHAVIK SANG PATEL CHOWK -BHUJPUR

- PROCEDURE FOR MEMBER REGISTRATION
- First open the **bhujpurmamalmmapc.org**
- Screen open in your browser



After open the site you click on **'NEW MEMBER'**

- After click on 'NEW MEMBER'
- Screen open in your browser as **"NEW FAMILY ENTRY"**
- Fill the necessary details in entry and Enter your password which you want and save the record
- After saving the record your screen display your Member Id.
- Please write or memories your MEMBER ID OR PASSWORD.




The screenshot shows a web browser window with the URL <https://bhujpurmamamap.org/newfamily.asp>. The page features a header with the logo of 'श्री मामल माता' and a navigation menu. The main content area is a form titled 'New Family Entry' with the following fields:

Family Head	First Name	Father/Husband	Grand Father	Surname
Male	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>
Special Name	<input type="text"/>			
Village Name	<input type="text"/>			
Flat/room no / Building Name	<input type="text"/>			
Road/Lane name	<input type="text"/>			
Land mark	<input type="text"/>			
Area	<input type="text"/>			
Pincode	<input type="text"/>			
City	<input type="text"/>			
Home Landline	<input type="text"/>			
Home Mobile	<input type="text"/>			
Please fill out this field: Personal information of Head of Family				
Relation	SELF			
Date of Birth	<input type="text"/>	Date of Marriage	<input type="text"/>	
Blood Group	<input type="text"/>	Medi-claim	<input type="text"/>	
Education	<input type="text"/>			
Profession	<input type="text"/>	Designation	<input type="text"/>	
Office Name	<input type="text"/>			
Office Address	<input type="text"/>			
Industry	<input type="text"/>	Sub Industry	<input type="text"/>	
Mobile No	<input type="text"/>	Whatsapp No	<input type="text"/>	
Email Id	<input type="text"/>			
In-law Name	<input type="text"/>			
Password	<input type="password"/>			
Verification Code	<input type="text"/>			
Enter Above Verification Code	<input type="text"/>			
<input type="button" value="SAVE RECORD"/>				

At the bottom of the page, there is a footer with the text: 'All Rights Reserved 2011 © Bhujpur Mamama Portal Choo. Powered by'.


Then after go to 'LOGIN EXISTING MEMBER'

- After clicking on 'LOGIN EXISTING MEMBER' you have display screen of 'MEMBERS LOGIN'
- Enter your login id or password



Following screen and Menu display

- The screen display following options.
- **EDIT MAIN INFO**
- **NEW MEMBER**
- **EDIT MEMBER**
- **ADD NIYANI**
- **EDIT NIYANI**
- **UPLOAD PHOTO**
- **LOGOUT**



1. EDIT MAIN INFO

You will edit your information which is submitted in 'NEW FAMILY ENTRY'

2. NEW MEMBER

You will enter your family member details in this menu.

3. EDIT MEMBER

You will edit your family member details in this menu.

4. ADD NIYANI

You will enter your Niyani details in this menu.

5. EDIT NIYANI

You will edit details of Niyani in this menu.

6. UPLOAD PHOTO

You will upload your and your family photo in this menu

7. After all procedure you will

'LOGOUT'

If you need any HELP you may contact us.

"JAY MATAJI"